

ત્વરિત જાહેરાત માટે

આ વસંતે લાઇવ ફોમ દ રોઝ ઓનલાઇન કાર્યક્રમો બ્રેમ્પટનમાં ફરી થશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (16 માર્ચ 2021) – લાઇવ કાર્યક્રમની શક્તિ અનુભવો અને આપણા ઘરના જ જોરદાર કલાકારો પાસેથી મનોરંજનનો સ્વાદ આ વસંતમાં ચાખો જ્યારે દ રોઝ બ્રેમ્પટન ઓનલાઇન માર્ગે લાઇવ ફોમ દ રોઝની 15મી વર્ષગાંઠની સિઝન ચાલુ રાખશે.

સમાજના આરોગ્ય અને સલામતીનું રક્ષણ અને પ્રોવિશ્યલ તથા પીલ પબ્લિક હેલ્થની માર્ગદર્શિકાને અનુરૂપ દ રોઝ વિમિઓ (Vimeo) મારફતે પ્રેક્ષકોને મૈનસ્ટેજ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરશે. પ્રેક્ષકોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી નિર્મિતીઓનો લાભ મળશે; જ્યાં તજ્જ ટેકનિકલ નિર્માણ ટીમ હશે; કન્ટેન-એજ જીવંત ઈવેન્ટ પ્રસારણ; અને, મનોરંજનના રોમાંચથી ભરી દેતા નામો હશે.

આવનાર કાર્યક્રમોમાં સમાવેશ થશે:

- 18 માર્ચ 2021 (સાંજે 8:00 EST) - વિશેષ મહેમાન માર્ક કેસ્લો (Mark Kelso) સાથે રિવર નોર્થ ડુઓ (River North Duo)
- 20 માર્ચ 2021 (સાંજે 8:00 EST) - દીસ ઈઝ બ્રેમ્પટન (This is Brampton): લાઇવ ઓનલાઇન (Live Online), જેનું નિર્દેશન ક્વિરિઆસિટી (Queeriahcity) કરશે
- 25 માર્ચ 2021 (સાંજે 8:00 EST) - સડનલી મમ્મી (Suddenly Mommy) માં એન-મેરી શેક્લર (Anne-Marie Scheffle)
- 27 માર્ચ 2021 (સાંજે 7:30 EST) - વર્લ્ડ્સ ઇન મ્યુઝિક (Worlds in Music) (દ રોઝ ઓર્કેસ્ટ્રા [The Rose Orchestra])
- 28 માર્ચ 2021 (બપોરે 1:00 EST) - એલિઝાબેથ ગ્લેન-કોપલેન્ડ (Elizabeth Glenn-Copeland) અને ઈએન કેટેકુ (Ian Keteku)નો વાર્તાલાપ
- 01 એપ્રિલ 2021 (સાંજે 8:00 EST) - દીસ ઈઝ બ્રેમ્પટન (This is Brampton): લાઇવ ઓનલાઇન (Live Online), જેનું નિર્દેશન સાઉન્ડ્રાઇવ રેકોર્ડ્સ (Soundrive Records) કરશે
- એપ્રિલની 8 થી 10, 2021 (સાંજે 7:30 EST) - સોંગ્સ ફોર અ ન્યુ વર્લ્ડ (Songs for a New World) (બ્રેમ્પટન મ્યુઝિક થિએટર) (Brampton Music Theatre)
- 10 એપ્રિલ 2021 (બપોરે 1:00 EST) - સોંગ્સ ફોર અ ન્યુ વર્લ્ડ (Songs for a New World), મેટિની શો (બ્રેમ્પટન મ્યુઝિક થિએટર) (Brampton Music Theatre)

આજ દિન સુધી, લાઇવ ફોમ દ રોઝમાંથી નિર્દેશન કરનારાઓ અને સહ-રજૂઆત કર્તાઓમાં સામેલ રહ્યા છે: બ્રેમ્પટન મ્યુઝિક થિએટર; દ રોઝ ઓર્કેસ્ટ્રા; બી-જેઝ્ડ (B-Jazzed); ન્યુ થિઅરી રેડિયો (New Theory Radio); ઓફ દ રેકોર્ડ (Off the Record); સાઉન્ડ ડ્રાઇવ

રેકોર્ડ્સ (Soundrive Records); સ્ટેન્ડ અપ સ્ટિચ્ઝ (Stand-up Stitches); ટ ફોલ્ડ (The FOLD) (ફેસ્ટિવલ ઓફ લિટરરી ડાઈવર્સિટી) (Festival of Literary Diversity); ક્વિરિઆસિટી (Queeriahcity); અને, આઅર વિમેન્સ વોઈસિસ (Our Women's Voices). ભૂતકાળના રજૂઆતકર્તાઓમાં સમાવેશ છે: વર્જિનિયા ટૂ વેગાસ (Virginia to Vegas); ક્રાઉન લેન્ડ્સ (Crown Lands); મેસ્ટ્રો ફ્રેશ વેસ (Maestro Fresh Wes); ટ્વિન ફ્લેમ્સ (Twin Flames); ટાયલર શો (Tyler Shaw); રોન હોક્કિન્સ (Ron Hawkins); હાવિઆ માર્ટી (Haviah Mighty); અને, ટોક્યો પોલીસ ક્લબ (Tokyo Police Club) જે સિટી ઓફ બ્રેમ્પટનની નુતન વર્ષની આગલી સાંજની ઉજવણીઓનો ભાગ હતો.

ગત માર્ચમાં જ્યારે ટ રોઝ બ્રેમ્પટન બંધ થયું ત્યારે આ સ્થળ દ્વારા પ્રેક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાઓની નવી જરૂરિયાતોને સંતોષવા માટેનું કાર્ય મફત ઓનલાઈન કાર્યક્રમો ટ રોઝ એટ હોમ (*The Rose at Home*) દ્વારા શરૂ કરાયું હતું એપ્રિલથી ઓગસ્ટ, ટીસ ઈઝ બ્રેમ્પટન: લાઈવ ઓનલાઈન દ્વારા 23 કન્સર્ટ્સનું નિર્માણ કાર્ય થયું જેમાં 42 સ્થાનિક કલાકારોએ ભાગ લીધો અને જે વિશ્વભરના 2,56,000 કરતા વધુ દર્શકોને આકર્ષી શક્યું. ટ રોઝ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોની રજૂઆત પણ થઈ જે સામાજિક પ્રભાવ અને કલા કેન્દ્રિત હતાં જેનાથી તમામ વયના દર્શકોના જીવન પ્રભાવિત કરી શકાયા.

ટ રોઝ, મેરિડિયન (Meridian)નો દિલથી આભાર વ્યક્ત કરે છે જેઓ લાઈવ ફ્રોમ ટ રોઝ રજૂ કરનાર પ્રાયોજક હતાં. લોકો લાઈવ ફ્રોમ ટ રોઝની મફત ટિકિટો અહીંથી બૂક કરી શકશે therosebrampton.ca

સુવાક્યો

ટ રોઝ બ્રેમ્પટન કલાકારોને મદદરૂપ થતા રહ્યા છે, મહત્વપૂર્ણ પ્રેક્ષકો અને દર્શકો સાથે જોડાયેલા રહ્યા છે અને પોતાના વૈશ્વિક ક્ષિતિજો હજુ વધુ વિસ્તારે છે. અત્યાર સુધી, ટ રોઝ દ્વારા 50 કરતા વધુ કલાકારોને ચુકવણીપાત્ર તકો આપવામાં આવી છે જેમાંથી 36 કલાકારો સ્થાનિક હતાં અને 15 નિ:શુલ્ક ઓનલાઈન કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. અમને અમારાં રહેવાસીઓ માટે ઘરે બેસીને સુરક્ષિત રીતે આનંદ માણી શકાય એવા ગુણવત્તાયુક્ત પ્રોડક્શન નિરંતર આપતા રહેવાનું ગૌરવ છે!"

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રેમ્પટન

લાઈવ ફ્રોમ ટ રોઝ દૂર દૂરના સમુદાયોમાં પહોંચ્યું છે અને બ્રેમ્પટનને એક તકોથી ભરેલા શહેર તરીકેની જાહેરાત કરી છે. કલાકારો માટે વ્યવસાયિક ટેકો અને ચુકવણીપાત્ર તકો ઊભી કરીને લાઈવ ફ્રોમ ટ રોઝ દ્વારા આપણા સ્થાનિક કલા સમાજ પર સીધો અને સકારાત્મક પ્રભાવ પડ્યો છે."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"ઓનલાઈન પ્રોગ્રામિંગ મારફતે 10,000 કરતા વધુ દર્શકોએ ટ રોઝ બ્રેમ્પટન દ્વારા થયેલ કાર્યક્રમો પોતાના ઘરની છાયામાં અને સલામતીમાં માણ્યા છે. 1,700 કરતા વધુ ટિકિટો બૂક થયા બાદ અને 17 દેશોના દર્શકો સાથે લાઈવ ફ્રોમ ટ રોઝ કુદકેને ભૂસકે વધુને વધુ રસ ઊભો કરી રહ્યું છે."

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

"દ રોજ સુલભતા અને કલા માટે પ્રતિબદ્ધતા ધરાવે છે." COVID-19ના રોગચાળા દરમિયાન દર્શકોને આનંદ, આશા અને જીવંત કાર્યક્રમોના પ્રભાવની આવશ્યકતા છે. આવા પડકારરૂપ સમયમાં આપણા સમાજને મદદરૂપ થવા આ સિઝનમાં દ રોજ બ્રેમ્પટનના ઓનલાઇન કાર્યક્રમો નિઃશુલ્ક છે."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

"દ રોજ ખીલતું જ રહેશે. અમે આ ઉદ્યોગના આગેવાન તરીકેની કેડી કંડારી ચુક્યા છીએ જે અમારા ઓનલાઇન પ્રોગ્રામિંગ અને અમારા કલાકારો તેમજ પરફોર્મિંગ આર્ટિસ્ટની ટીમના નોંધપાત્ર ચાતુર્યને કારણે છે. લિવિંગ રૂમ કન્સર્ટ્સ જે અમારું વેન્યુ બંધ થયાના એક જ સપ્તાહમાં શરૂ થયા હતાં તેમજ અમારા મંચ પરથી થતા વ્યવસાયિક લાઇવસ્ટ્રીમ્સ આખા વિશ્વમાં જોવાય છે અને અમને અત્યાર સુધીની અમારી સિઝનનું ગૌરવ છે. અમે અમારા દર્શકો, આપણા મેયરશ્રી અને સિટીના કાઉન્સિલરોના તેમના અમૂલ્ય ટેકા માટે આભારી છીએ. બ્રેમ્પટન તેમજ બહાર માટે અમારી પાસે માણવાલાયક હજુ ઘણા જોરદાર કન્સર્ટ્સની કતાર છે."

- સ્ટિવન સ્કિપર (Steven Schipper), એગ્રિક્યુલ્ચર આર્ટિસ્ટિક ડાયરેક્ટર, પરફોર્મિંગ આર્ટ્સ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](#).

દ રોજ બ્રેમ્પટન તે બ્રેમ્પટનનું પ્રિમિયર પરફોર્મિંગ આર્ટ્સનું સ્થળ છે અને તે ડાઉનટાઉનના હાર્દની એક આઈકોનિક લાક્ષણિકતા ગણી શકાય. શહેરના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે તે સ્થાનિક અને વિશ્વ વિખ્યાત કલાકારો માટેનું ગંતવ્ય સ્થાન છે જે બ્રેમ્પટન અને બહારના લોકો એક જોરદાર સેટિંગમાં બહોળી શ્રેણીની પ્રતિભાઓનો અનુભવ કરવાની તકો પૂરી પાડે છે. સ્થાપત્ય અને ધ્વનિતંત્રની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ હોવાથી દ રોજ એવું સ્થાન છે જ્યાં બ્રેમ્પટનમાં જન કૂંકાય છે.

લાઇવ ફોમ દ રોજ ખાતે બહુ વિષયક પ્રોડક્શનો જોવા મળે છે જેમાં નાટ્યકલા, સંગીત, હાસ્યરસ, પારિવારિક અને સાંસ્કૃતિક ઇવેન્ટ્સ સમાયેલા છે. દ રોજ સ્વદેશી કલાકારોને ઝળકાવવા માટે અને સ્થાનિક સંગઠનો સાથે ભાગીદારી કરીને જેની તે સેવા કરે છે તે સમુદાયને પ્રદર્શિત કરવા, પાલન કરવા અને તેને વધારી લેવા પ્રતિબદ્ધ છે. અમે સક્રિયપણે કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ અને ઉલ્લેખનીય કલાકારોને આગળ લાવીએ છીએ. અમારું લક્ષ્ય કાર્યક્રમ આપતા કલાકારોને અસામાન્ય અનુભવો પૂરા પાડવા સાથે દર્શકોને મનોરંજન આપીને પ્રેરિત કરવાનું છે.

મિડિયા સંપર્ક :

ગુરવિંદર સિંઘ (Gurvinder Singh)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-2028 | Gurvinder.A.Singh@brampton.ca